

25 સપ્ટેમ્બર 2018

## એડવાન્સ વોટિંગનો પ્રારંભ 2 ઓક્ટોબર 2018

બ્રમ્પટન, ઓન્ટારિયો – બ્રમ્પટન મ્યુનિસિપલ ચુંટણીના એડવાન્સ વોટિંગનો પ્રારંભ આવતે અઠવાડિયે થશે, અને તે ઓક્ટોબર મહિનામાં આઠ દિવસ સુધી હાથ ધરાશે. ઓક્ટોબર 2, 3, 4, 6, 9, 10, 11 અને 13ના રોજ એડવાન્સ વોટિંગ હાથ ધરાશે. સંપૂર્ણ યાદી નીચે મુજબ છે. મતદાતાઓ ઈન્ટરએક્ટિવ ટૂલ નો ઉપયોગ પણ [brampton.ca/bramptonvotes](http://brampton.ca/bramptonvotes) પર કરી શકશે જેથી પોતાના રહેઠાણથી સૌથી નજીકના એડવાન્સ વોટિંગ સ્થળને શોધી શકે.

### એડવાન્સ વોટિંગ સ્થળો

મંગળવારથી ગુરુવાર, ઓક્ટોબર 2-4, સવારે 8:30 થી સાંજે 8

- બ્રમ્પટન સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ પશ્ચિમ  
(Brampton City Hall, 2 Wellington St W)

શનિવાર, ઓક્ટોબર 6 અને શનિવાર ઓક્ટોબર 13ના રોજ સવારે 10 થી સાંજે 5

- બ્રમ્પટન સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ પશ્ચિમ  
(Brampton City Hall, 2 Wellington St W)
- બ્રમ્પટન સોક્કર સેન્ટર, 1495, સેન્ડલવુડ પાર્કવે પૂર્વ  
(Brampton Soccer Centre, 1495 Sandalwood Pkwy E)
- કેસિ કંપબેલ કમ્યુનિટી સેન્ટર, 1050 સેન્ડલવુડ પાર્કવે પશ્ચિમ  
(Cassie Campbell Community Centre, 1050 Sandalwood Pkwy W)
- સેચ્યુરી ગાર્ડન્સ રિક્રિએશન સેન્ટર 340 વોડન સ્ટ્રીટ પૂર્વ  
(Century Gardens Recreation Centre, 340 Vodden St E)
- ડેવિડ સુઝુકી સેકન્ડરી સ્કૂલ, 45 ડેવિસેમ ડ્રાઈવ  
(David Suzuki Secondary School, 45 Daviselm Dr)
- અર્ન્સક્લિફ રિક્રિએશન સેન્ટર, 44 ઈસ્ટબોર્ન ડ્રાઈવ  
(Earnscliffe Recreation Centre, 44 Eastbourne Dr)
- ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર, 10150 ધી ગોર રોડ  
(Gore Meadows Community Centre, 10150 The Gore Rd)
- ગ્રીનબ્રિઅર રિક્રિએશન સેન્ટર, 1100 સેન્ટ્રલ પાર્ક ડ્રાઈવ  
(Greenbriar Recreation Centre, 1100 Central Park Dr)

- જીમ આર્ચડેકિન રિક્રિએશન સેન્ટર, 292 કોનેસ્ટોગા ડ્રાઇવ  
(Jim Archdekin Recreation Centre, 292 Conestoga Dr)
- સાઉથ ફ્લેચર સ્પોર્ટ્સપ્લેક્સ, 500 રે લોસન બૂલેવર્ડ  
(South Fletcher's Sportsplex, 500 Ray Lawson Blvd)

મંગળવારથી ગુરુવાર, ઓક્ટોબર 9-11, સવારે 8:30 થી સાંજે 8

- સિવિક સેન્ટર, 150 સેન્ટ્રલ પાર્ક ડ્રાઇવ  
(Civic Centre, 150 Central Park Dr)

મતદાન માટે એડવાન્સ વોટિંગની કેટલીક તારીખો થેન્ક્સગિવિંગ સપ્તાહના અંતે આવે છે જેથી તમામ મતદાતાઓ માટે વધુ સગવડતાભર્યું રહે, જેમાં લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ લોંગ વીકએન્ડ માટે ઘરે પાછા ફર્યા હોય. ઐતિહાસિક રીતે જોતા, તમામ લાયકાત ધરાવતા મતદાતાઓ સાથે તુલના કરીએ તો યુવા લોકો (18-29 વર્ષની વયના)ની મતદાનની માત્રા સૌથી નિમ્ન રહી છે. આના વિશે વધુ માહિતી [સીટીની વેબસાઇટ](#) પર ઉપલબ્ધ થશે.

વધારાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

- મતદાનનો દિવસ છે સોમવાર, 22 ઓક્ટોબર 2018 સવારે 10 થી સાંજે 8
- મતદાન કરવા માટે તમારું નામ અને બ્રેમ્પટનનું સરનામું ધરાવતું ઓળખપત્ર અને તમને કેનેડા પોસ્ટ ટપાલમાં પ્રાપ્ત થયેલ વોટર નોટિસ કોઈ પણ એડવાન્સ વોટિંગ સ્થળો પર સાથે લઈ જશો.
- જો તમને વોટર નોટિસ પ્રાપ્ત ન થઈ હોય તો બની શકે કે તમે મતદાતાની સૂચિ પર નહીં હશો, પરંતુ મતદાન કરવાના સ્થળ પર તમને સૂચિમાં ઉમેરી શકાશે. તમારે અવશ્ય [જરૂરી ઓળખપત્ર](#) સાથે લાવવાનું રહેશે.
- તમને મતદાતાની યાદી પર ઉમેરવાની વિનંતી કરવામાં આવી હોય અથવા ઓનલાઇન તમારી માહિતી અદ્યતન કરી હોય તો તમારે મત આપવાના સ્થળે ઓળખપત્ર પણ લાવવાનું રહેશે.
- તમામ એડવાન્સ વોટિંગ સ્થળો પર તમારા ઉપયોગ માટે સુલભ મતદાન એકમ હશે.
- પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા માટે આ [‘મતદાન માર્ગદર્શિકા’](#) ઉપયોગી નીવડશે.
- જો તમે મતદાનના દિવસે એડવાન્સ વોટિંગ સ્થળ પર પહોંચી શકો નહીં તો [પ્રોક્સી મતદાન](#) વિશે વધુ માહિતી મેળવો.
- મતદાન સંબંધિત કોઈ પણ અન્ય પ્રશ્નો માટે સીટી વેબસાઇટ પર [વારંવાર પૂછાતા પ્રશ્નોનો વિભાગ](#) નો સંદર્ભ લો.

**ક્વોટ:**

"જે મતદાતાઓને નિયત સમય પહેલા મત આપવાની ઈચ્છા હોય તેઓ માટે ઘણી બધી એડવાન્સ વોટિંગની તકો છે. મતદાન કરવું તે આપણા શહેરના વિકાસ માટેનો અગત્યનો માર્ગ છે અને અમે તમામ લાયકાત ધરાવતા મતદાતાઓને 2018 બ્રેમ્પટન નગરપાલિકા ચૂંટણી

(Brampton Municipal Election)માં મત આપવા પ્રોત્સાહિત કરીએ છીએ અને બ્રેમ્પટનના ભવિષ્યને ચિતરવા વધુ સક્રિય થવા જણાવીએ છીએ."

- પીટર ફે, 2018 બ્રેમ્પટન નગરપાલિકા ચૂંટણી (Brampton Municipal Election) માટેના સીટી કલર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર

-30-

**બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે.** અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

બ્રાયન સ્ટિટલ (Brian Stittle)

સીનિયર મીડિયા કોર્ડિનેટર

સીટી ઓફ બ્રામ્પટન

905.874.2143 | [brian.stittle@brampton.ca](mailto:brian.stittle@brampton.ca)